

આર.ટી.આઈ. અધિનિયમ-૨૦૦૫ની કલમ-૪(૧)ખ(૧) થી (૧૭) બાબત  
**મધ્યસ્થ મહેકમ (લીગલ સેક્શન) ની માહિતી.**

<p>૪(૧)ખ(૧)</p>	<p><b>પોતાના વ્યવસ્થા તંત્ર,કાર્યો અને ફરજોની વિગત:-</b></p> <p>-મધ્યસ્થ મહેકમ ખાતાનુ લીગલ સેક્શન એપ્રિલ-૨૦૦૮ થી અસ્તિત્વમાં આવેલ. તે અગાઉ મધ્યસ્થ મહેકમ ખાતાના (પી) વિભાગ ધ્વારા જુદા જુદા ખાતા/ઝોનોના કોર્ટ કેસોની કાર્યવાહી કરવામાં આવતી હતી.</p> <p>-મધ્યસ્થ મહેકમ (લીગલ)સેક્શનને સક્ષમ સત્તા ધ્વારા લેખિત કે મૌખિક આદેશથી સુપ્રત થયેલ મહેકમ સંબંધી વ્યક્તિગત/પોલીસી મેટરના કેસોમાં સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મહેકમને લાગત ખાતાને સ્પર્શતા પ્રશ્નોમાં અભિપ્રાય-કાનુની માર્ગદર્શન આપવાની કામગીરી.</p> <p>- નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ સુરતની નામદાર લેબર કોર્ટ તથા નામદાર ઔદ્યોગિક કોર્ટમાં ચાલતા કેસોમાં સુરત મહાનગરપાલિકા તરફના પેનલના વકીલશ્રીઓ સાથે સંકલનમાં રહી કેસોને લગતા જરૂરી દસ્તાવેજી પુરાવાઓના આધારે વકીલશ્રીએ તૈયાર કરાવેલ જવાબો આસી. લો ઓફિસરશ્રી (લીગલ સેક્શન)ના અભિપ્રાય મેળવ્યા બાદ સક્ષમ અધિકારીની સહીવાળા જવાબ જે તે કોર્ટમાં વકીલશ્રી મારફત રજૂ કરવા. મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, સુરતના કેસોમાં રૂબરૂ હાજર રહી રજૂઆતો કરી સક્ષમ અધિકારીના સહીવાળા જવાબ રજૂ કરવા.</p> <p>-ઉપરોક્ત તમામ નામદાર કોર્ટોમાં ઠરાવની તારીખે સંસ્થાએ રોકેલા પેનલના એડવોકેટશ્રી સાથે રહી તેઓની સુચના મુજબ મધ્યસ્થ મહેકમ (લીગલ સેક્શન ) હસ્તકના કેસો સંબંધી દસ્તાવેજો તૈયાર કરવા.</p> <p>-જુદા જુદા યુનિયનો ધ્વારા દાખલ કરેલ પોલીસી મેટરના કેસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તથા સુરતની નામદાર લેબરકોર્ટ તથા ઔદ્યોગિક અદાલતમાં ચાલતા કેસોમાં વકીલ સાથે સંકલનમાં રહી મધ્યસ્થ મહેકમ ખાતાના (લીગલ સેક્શન) ધ્વારા કોર્ટ સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે.</p> <p>-નિકાલ થયેલ કોર્ટ કેસોના વકીલોના બીલોના ચુકવણા અંગે લો ઓફિસરશ્રી (કાયદા વિભાગ)નો વ્યાજબીપણાનો અભિપ્રાય મેળવી, મધ્યસ્થ મહેકમ (લીગલ સેક્શન) હસ્તકના કેસો સંબંધી વકીલોના બીલ બનાવી ચુકવણીની કાર્યવાહી થવા હિસાબી શાખામાં બીલો મોકલવામાં આવે છે.</p>
-----------------	---